




શિક્ષણક્ષેત્રે ૧૦૦ વર્ષથી કાર્ય કરતી સંસ્થા

ગુજરાત વિદ્યાપીઠ (૧૯૨૦ - ૨૦૨૧)

આજીવન શિક્ષણ અને વિસ્તરણ વિભાગ, પ્રાણજીવન વિદ્યાર્થીગૃહ, ગુજરાત વિદ્યાર્થીગૃહ,
ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ



...Learn as if
you were to live forever.
- Mahatma Gandhi

NAAC- A ગ્રેડ

વિદ્યાપીઠનો પરિચય

ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ૧૮ ઓક્ટોબર, ૧૯૨૦ ના રોજ ગાંધીજીના હસ્તે રાષ્ટ્રીય વિદ્યાપીઠ તરીકે થઈ હતી. ગુજરાત વિદ્યાપીઠના મૂલ્યશિક્ષણ આધારિત પ્રયોગોના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વના પ્રદાનને કારણે ભારત સરકારે ઈ.સ. ૧૯૬૩ માં વિશ્વવિદ્યાલય અનુદાન આયોગે અધિનિયમ હેઠળ ગુજરાત વિદ્યાપીઠને યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો. ગુજરાત વિદ્યાપીઠમાં ૨૦૦૪થી માનવ સંસાધન વિકાસ અને વ્યવસ્થાપનનો ૨(બે) વર્ષનો અનુસ્નાતક કક્ષાનો MA-HRDનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવેલ છે

શૈક્ષણિક અભ્યાસક્રમો

અભ્યાસક્રમ	સમયગાળો	લઘુત્તમ જરૂરિયાત
એમએ એચઆરડી	૨ વર્ષ (૪ સત્ર)	કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક
એમ.ફિલ. પ્રૌઢશિક્ષણ/ વસતિ શિક્ષણ	યુજીસીના નિયમ પ્રમાણે	કોઈપણ વિદ્યાશાખામાં પારંગત
પીએચ.ડી. પ્રૌઢશિક્ષણ/ વસતિ શિક્ષણ	યુજીસીના નિયમ પ્રમાણે	કોઈપણ વિદ્યાશાખામાં પારંગત/એમફિલ



ધ્યેય

MA - HRD નો અભ્યાસક્રમ શરૂ કરવા પાછળનો ગુજરાત વિદ્યાપીઠનો મુખ્ય ઉદ્દેશ ઔદ્યોગિક ગૃહો, સ્વૈચ્છિક સંગઠનો, બેંક, હોસ્પિટલ, હોટેલ્સ, વર્તમાનપત્રોના, પ્રેસ, સરકારી સંગઠનો, શૈક્ષણિક ક્ષેત્રોમાં તાલીમ પામેલ કર્મશીલ કાર્યકરો પૂરા પાડવાનો અને સંપોષિત માનવ વિકાસ માટે આ અભ્યાસક્રમ મહત્વ ધરાવે છે.

ઉજ્જવળ તક

અભ્યાસ પૂરો કર્યા બાદ વિદ્યાર્થીઓને વિવિધ ઔદ્યોગિક ગૃહો, સ્વૈચ્છિક સંગઠનો, સહકારી, અર્ધ સરકારી અને સરકારી સંસ્થાઓમાં વ્યવસ્થાપન ક્ષેત્રે કારકિર્દી ઘડતરની ઉજ્જવળ તકો ઉપલબ્ધ છે. તેઓ સ્વતંત્ર વ્યવસાય પણ શરૂ કરી શકે છે. મોટાભાગના વિદ્યાર્થીઓને અભ્યાસના ચોથા સત્રમાં જ વ્યવસાયિક તાલીમ દરમ્યાન નોકરીની તક મળી જાય છે.

વિશિષ્ટતાઓ

- ગાંધીવિચારના મજબૂત અને આધારસ્તંભ સાથે ગુજરાતી માધ્યમમાં વ્યવસ્થાપનક્ષેત્રે મૂલ્ય આધારિત અનુસ્નાતક અભ્યાસક્રમની અનોખી શિક્ષણ પદ્ધતિ
- શાંતિપૂર્ણ, સમૃદ્ધ પરિસર સાથે શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ જેવી કે મલ્ટી-મિડીયા પ્રોજેક્ટર સહિત સજ્જ વર્ગખંડો, પ્રાર્થના ખંડ, ઓડિટોરિયમ, રમત-ગમત અને ઇત્તર પ્રવૃત્તિની સુવિધાઓ, ઇન્ટરનેટ જોડાણ સાથેની કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી વગેરે.
- વિદ્યાર્થી કૌશલ્ય વિકાસ અને અંગ્રેજીભાષાના શિક્ષણ માટેની સુવિધા
- ભાઈઓ-બહેનો માટે જરૂરિયાત મુજબ અલાયદી કોરોના મુક્ત છાત્રાલયની સુવિધા, સમૃદ્ધ પુસ્તકાલય, સ્પર્ધાત્મક પરીક્ષા માટેની જરૂરી સગવડતા, આરોગ્ય કેન્દ્ર, યોગ કેન્દ્ર, સ્વીમીંગપુલની સગવડ,
- ફરજિયાત ખાદીનો પોશાક, પ્રાર્થના અને કાંતણ

એલ્યુમની

વિદ્યાર્થીઓના લાભાર્થે એલ્યુમની એસોસિએશનની રચના કરવામાં આવી છે. આ માટે સંસ્થાનો હેતુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સતત સંપર્ક અને વિચાર વિમર્શથી નવા સૌપાનો શોધવા તેમજ વિકાસની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન, પ્રેરણા અને સાથ આપવાનો છે.

ફી

ફી માળખું - સત્ર -૧ ની ફી રૂ.૧૨૦૦૦ (અંદાજિત)

પ્રવેશ : ગુજરાત વિદ્યાપીઠની વેબસાઇટ પર થી રજીસ્ટર કરી ઓનલાઇન પ્રવેશ મેળવી શકશે. (પ્રવેશ વહેલા તે પહેલાના ધોરણે)

શિષ્યવૃત્તિ

SC, ST, OBC વિદ્યાર્થીઓને સરકાર દ્વારા નિયમ મુજબ શિષ્યવૃત્તિ તથા અન્ય વિદ્યાર્થીઓને ગુજરાત વિદ્યાપીઠ દ્વારા મેરીટ આધારિત વિશેષ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.

સંપર્ક

આજીવન શિક્ષણ અને વિસ્તરણ વિભાગ
ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૧૪
ફોન - ૦૭૯-૪૦૦૧૬૩૯૦/૮૬

Website

www.gujaratvidyapith.org

ઇ-મેલ

dce@gujaratvidyapith.org